

11 OCTOBER 1954

After all, for the greatest as for the smallest of us our strength is not our own but given to us for the game that has to be played, the work that we have to do. The strength may be formed in us, but its present formation is not final, - neither formation of power nor formation of weakness. At any moment the formation may change – at any moment one sees, especially under the pressure of Yoga, weakness changing into power, the incapable becoming capable, suddenly or slowly the instrumental consciousness rising to a new stature or developing its latent powers. Above us, within us, around us is the All-Strength and it is that that we have to rely on for our work, our development, our transforming change. If we proceed with the faith in the work, in our instrumentality for the work, in the Power that missions us, then in the very act of trial, of facing and surmounting difficulties and failures, the strength will come and we shall find our capacity to contain as much as we need of the All-Strength of which we grow more and more perfect vessels.

29.2.1932

SRI AUROBINDO

૧૧ ઓક્ટોબર ૧૯૫૪

મહાલક્ષ્મી પૂજન

છેવટે જોતાં તો, આપણામાંના મહાનમાં મહાન માણસની તેમ જ નાનામાં નાના માણસની શક્તિ તે આપણી પોતાની શક્તિ નથી, પણ જગતમાં આપણે જે લીલા ખેલવાની છે, જે કાર્ય કરવાનું છે તેને માટે તે આપણને આપવામાં આવેલી છે. એ શક્તિ આપણી અંદર બંધાતી લાગે છે ખરી, પણ એનું અત્યારનું બંધારણ -- આપણામાં રહેલા સામર્થ્યનું બંધારણ કે અશક્તિનું બંધારણ તે છેવટનું નથી. કોઈ પણ ક્ષણે એ બંધારણ બદલાઈ શકે છે -- કોઈ પણ ક્ષણે આપણને એ દેખાઈ આવે છે, ખાસ કરીને તો યોગના દબાણ હેઠળ, કે માણસની દુર્બળતા સબળતામાં પલટાઈ જતી હોય છે, અશક્ત માણસો સમર્થ બની જતા હોય છે, આપણી કરણરૂપ ચેતના એકાએક જ અથવા તો ધીરે ધીરે એક નવી ઊંચાઈએ પહોંચી જતી હોય છે, યા તો પોતાની ગુપ્ત શક્તિઓને વિકસાવી રહેલી હોય છે. આપણી ઉપર, આપણી અંદર, આપણી ચારે મેર પ્રભુની સર્વશક્તિ આવી રહેલી છે અને આપણા વિકાસ માટે, આપણા રૂપાંતરસર્જક પરિવર્તન માટે આપણે તેનું જ આલંબન લેવાનું છે. આપણા કાર્યમાં આ શ્રદ્ધા રાખીને જો આપણે આગળ વધીશું, એ કાર્ય માટેની આપણી કરણાત્મકતામાં, તેમ જ આપણને કાર્યમાં પ્રેરતી શક્તિમાં આ શ્રદ્ધા રાખીને કામ કરતા રહીશું તો પછી જે સમયે આપણી કસોટી થઈ રહી હશે, જે સમયે આપણે મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓનો સામનો કરતા હોઈશું તેમ જ તેમને પાર કરતા જતા હોઈશું તે જ વેળા આપણને શક્તિ આવી મળશે, એ સર્વશક્તિમાંથી આપણને જેટલી શક્તિની જરૂર હશે તેટલી શક્તિને ધારણ કરવા માટેનું સામર્થ્ય આપણને આવી મળશે અને આપણે એ સર્વશક્તિનાં વધુ ને વધુ પૂર્ણ એવાં કરણ બની રહીશું

૨૯.૨.૧૯૩૨

શ્રી અરવિન્દ



Prosperity

શ્રી માતાજીની  
સિદ્ધિ-રિદ્ધિ

2020

OCTOBER

૧ ઓક્ટોબર, ૨૦૨૦

— This month we bring you Puja Day Messages given in our Prosperity of October 1991 and November 1991. —

— આ મહિને ઓક્ટોબર ૧૯૯૧ અને નવેમ્બર ૧૯૯૧ ની "પ્રોસ્પેરિટી" માં આપેલા પૂજા દિવસના સંદેશા ફરી આપીએ છીએ. —



આશિષ પ્રસાદ

5 OCTOBER 1954

Whatever the appearance we must bear,  
Whatever our strong ills and present fate,  
When nothing we can see but drift and bale,  
A mighty Guidance leads us still through all.  
After we have served this great divided world  
God's bliss and oneness are our inborn right.  
A date is fixed in the calendar of the Unknown  
An anniversary of the Birth sublime:  
Our soul shall justify its chequered walk,  
All will come near that now is naught or far.

Savitri,  
B.1, C.4.

SRI AUROBINDO

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ☎ 0413-2331470

રવાના: દક્ષિણ કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ ☎ ૪૧૩-૨૩૩૧૪૭૦ • October 2020

<https://themothersprosperity.org>

૫ ઓક્ટોબર ૧૯૫૪

(દુર્ગાષ્ટમી)

ભલે ને આપણે આ સૌ આભાસો સહવા રહે,  
ભલે કો આપદા ઉગ્ર આપણે શિર ત્રાટકે,  
ભલે હો આજની જે કો યથેચ્છ આપણી દશા,  
ને સર્વત્ર ભલે હોય વિનાશ, અસહાયતા ---  
એવા યે સમયે એક પ્રચંડ માર્ગદર્શિકા  
શક્તિ કો અમને દોરે આ બધી ય સ્થિતિ વિષે.  
મહા આ જગની સેવા ભેદમાંહિ ડુબેલની  
આપણે કરતાં પૂરી, પ્રભુકેરી મુદા અને  
એકતા આપણો હક્ક જન્મસિદ્ધ બની રહે.  
પંચાંગે પ્રભુના એક નક્કી તારીખ છે થઈ,  
ભવ્ય કો જન્મની દિવ્ય વર્ષગાંઠ લખાઈ છે,  
આત્મ આ આપણો ત્યારે નિજની પચરંગિણી  
ગતિનું પૂર્ણ સાર્થક્ય દર્શાવી પૂર્ણ આપણે,  
ને આજે શૂન્ય જેવું વા દૂર દૂર પડેલ વા  
તે સંધું આવશે ત્યારે અમ પાસ નજીકમાં.  
'સાવિત્રી' શ્રી અરવિન્દ  
પર્વ ૧, સર્ગ ૪.

7 OCTOBER 1954

A Mother wisdom works in Nature's breast  
To pour delight on the heart of toil and want  
And press perfection on life's stumbling powers,  
Impose heaven-sentience on the obscure abyss  
And make dumb Matter conscious of its God.  
Although our fallen minds forget to climb,  
Although our human stuff resists or breaks,  
She keeps her will that hopes to divinise clay;  
Failure cannot repress, defeat o'erthrow;  
Time cannot weary her nor the Void subdue,  
The ages have not made her passion less;  
No victory she admits of Death or Fate.

Savitri,  
B.4, C.1.

SRI AUROBINDO

૭ ઓક્ટોબર ૧૯૫૪

(વિજયાદશમી)

માતા જ્ઞાનમયી એક હૃદયે પ્રકૃતિતણે  
ક્રિયાશીલ રહી : આ જે ક્ષુધાનું શ્રમનું જગત્  
તેહના ઉરમાં એ તો આનંદ રેડવા મથે,  
શક્તિઓ જિન્દગીકેરી સ્ખલનોમય તે પરે  
પૂર્ણતા સ્થાપવા એ હા સતત ક્રિયામાણ રહે,  
અંધાર તમસોકેરી ખીણને શિર સ્વર્ગની  
જ્યોત એ લાદવા ચાહે, મૂક આ જડતત્ત્વને  
એહના પ્રભુની પ્રત્યે સચિત્ એ કરવા ચહે.  
પડ્યાં અજ્ઞાનને ગર્ત અમ ચિત્ત ભુલી જતાં  
ઊર્ધ્વમાં ચડવું, ને આ માનવી મિટ્ટી આપણી  
વિરોધે પડતી, કિંવા તૂટીને ટુકડા થતી,  
તો યે એ જ્ઞાન-માતા હા નિજ સંકલ્પ ન ત્યજે;  
મિટ્ટીને કરવી દિવ્ય આશા તો એહને સદા,  
નૈષ્કલ્ય નહિ રે એનો સંકલ્પ થીજવી શકે,  
પરાજય નહિ એનું તજાવી વ્રત વા શકે,  
નહિ કાલ શકે અને થકવી, શૂન્ય સૃષ્ટિનું  
ન પરાસ્ત કરે એને, યુગોના યુગ આ બધા  
વહ્યા તો ય નહિ એનો ઉગ્ર સંકલ્પ રે લવ  
બન્યો મંદ, નહિ એ તો કેમે યે જીત મૃત્યુની  
અથવા વિધિની ક્યારે સ્વીકારે નિજની પરે.  
'સાવિત્રી' શ્રી અરવિન્દ  
પર્વ ૪, સર્ગ ૧.